

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટનને પ્રતિષ્ઠિત બજેટ પ્રેઝન્ટેશન ઍવોર્ડ મળ્યો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (મે 21, 2021) – સીટી ઓફ બ્રેમ્પટનને ગવર્નમેન્ટ ફાઇનાન્સ ઓફિસર્સ એસોસિએશન ઓફ ધી યુનાઇટેડ સ્ટેટ્સ એન્ડ કેનેડા (GFOA) તરફથી સતત પાંચમાં વર્ષે પ્રતિષ્ઠિત બજેટ પ્રેઝન્ટેશન ઍવોર્ડ મળ્યો છે.

આ ઍવોર્ડ સરકારી અંદાજપત્ર કામગીરીના ઉચ્ચતમ સિદ્ધાંતો સંતોષવામાં કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરીને, સીટી ઓફ બ્રેમ્પટન માટે નોંધપાત્ર ઉપલબ્ધિને દર્શાવે છે. આ પ્રતિષ્ઠિત બજેટ પ્રેઝન્ટેશન ઍવોર્ડ મેળવવા, સીટી ઓફ બ્રેમ્પટનને એક અસરકારક અંદાજપત્ર રજૂઆત માટે નીચે જણાવેલ સહિતની, રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત માર્ગરેખાઓ સંતોષવી પડી હતી:

- એક કાર્યનીતિ દસ્તાવેજ;
- એક નાણાકીય આયોજન;
- એક સંચાલન માર્ગદર્શિકા; અને,
- એક સંદેશાવ્યવહાર સાધન.

અંદાજપત્ર દસ્તાવેજોએ ઍવોર્ડ મેળવવા બંધી ચાર શ્રેણીઓમાં અને 14 અનિવાર્ય માપદંડોમાં નિપુણ ક્રમાંકન મેળવવું રહ્યું. બ્રેમ્પટન સીટી કાઉન્સિલે કાઉન્સિલના આ કાર્યકાળ દરમિયાન સતત ત્રીજા વર્ષ માટે મિલકત કરો અચળ રાખીને, અને અનામત ભંડોળમાં રેકોર્ડ \$114 મિલિયનનો ફાળો આપીને, વર્ષ 2021 નું બજેટ ડિસેમ્બર 9, 2020 નાં રોજ મંજૂર કર્યું હતું.

GFOA નાં બજેટ ઍવોર્ડ્સ પ્રોગ્રામમાં 1600 ઉપરાંત સહભાગીઓ છે. 20,500 ઉપરાંત સભ્યોને શ્રેષ્ઠ વ્યવહારો, વ્યાવસાયિક વિકાસ, સંસાધનો અને વ્યવહારુ સંશોધન પૂરું પાડીને, GFOA સરકારી નાણાંની જોગવાઈમાં ઉત્કૃષ્ટતાને આગળ વધારે છે.

અવતરણો (ક્વોટ્સ):

“આપણાં 2020 બજેટ માટે ગવર્નમેન્ટ ફાઇનાન્સ ઓફિસર્સ એસોસિએશનનો પ્રતિષ્ઠિત બજેટ પ્રેઝન્ટેશન ઍવોર્ડ જીતવો એક પ્રભાવશાળી ઉપલબ્ધિ છે, ખાસ કરીને COVID-19 મહામારીના પગલે. આ ઍવોર્ડ નાણાકીય પારદર્શકતા અને સુશાસનમાં નોંધપાત્ર ઉપલબ્ધિને પ્રતિબિંબિત કરે છે.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન, પ્રમુખ - બજેટ કમિટી

“સીટી ઓફ બ્રેમ્પટનને આ પ્રતિષ્ઠિત ઍવોર્ડ માટે અરજી કરીને તેઓ તે મેળવવામાં પાંચમાં વર્ષે સફળ રહ્યાં છે. બજેટ એક સહયોગી પ્રક્રિયા છે જ્યાં કાઉન્સિલ, કર્મચારીગણ અને જાહેર જનતા અને ધંધાકીય સમુદાયના સભ્યો શહેરના ભાવિને ઘડવામાં મદદરૂપ થાય છે. એક સ્પષ્ટ, પારદર્શક અને માહિતીપ્રદ બજેટ દસ્તાવેજ આપણને આ ઍવોર્ડ જીતવામાં મદદરૂપ થયું.”

- પૉલ વિસેંટે (Paul Vicente), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5, અને ઉપાધ્યક્ષ, બજેટ કમિટી

“અમને સરકારી અંદાજપત્ર કામગીરી માટે આ પ્રતિષ્ઠિત ઍવોર્ડ મેળવવામાં ગૌરવ થાય છે. આ ઉપલબ્ધિ આપણાં સમુદાયને શ્રેષ્ઠતમ આપવામાં ટીમ બ્રેમ્પટનની કટિબદ્ધતાનો પુરાવો છે, સુસંચાલિત શહેર બની રહેવા આપણાં પ્રયત્નોનો પડઘો પાડીને.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ટુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca